

B.Com. Semester - 6 (CBCS) Examination**Oct/Nov -2020****INDIRECT TAX LAW -2 (DSE-3)****Time: 2:00 Hours****Marks: 56****Instructions:**

1. Figures to the right indicate marks.
2. There are four questions in the question paper.
3. Write any one from Que.1 and Que.2
4. Que. 3 & 4 is Compulsory.

-
- પ્રશ્ન-1 સેન્ટ્રલ એક્સાઈઝનો અર્થ અને ખ્યાલને સમજાવો. (20)
અથવા
- પ્રશ્ન-1 (અ) તમે એક્સાઈઝબેલ માલનું મુલ્યાંકન કેવી રીતે કરશો? (10)
(બ) કયાં પ્રકારના માલ એક્સાઈઝબેલ છે? (10)
- પ્રશ્ન-2 CENVAT ઉપર નોંધ લખો. (20)
અથવા
- પ્રશ્ન-2 (અ) સેન્ટ્રલ એક્સાઈઝ જોબ વર્ક (10)
(બ) સમજાવો – SSI ને સેન્ટ્રલ એક્સાઈઝમાંથી મુક્તિ (10)
- પ્રશ્ન-3 કસ્ટમ ડ્યુટી શું છે? તેનો ખ્યાલ શું છે? (18)
અથવા
- પ્રશ્ન-3 કસ્ટમ ફાયદા હેઠળ પ્રાદેશિક પાણી (ટેરિટરીયલ વોટર) અને ઉચ્ચ સમુદ્રનો (હાઈ સીસ) અર્થ સમજાવો. (18)
- પ્રશ્ન-4 માલની આયાત અને નિકાસના કિસ્સામાં કસ્ટમ ફરજોના (ડ્યુટી) મુલ્યાંકનની પ્રક્રિયા શું છે? (18)
અથવા
- પ્રશ્ન-4 કસ્ટમ ફરજોના (ડ્યુટી) પ્રકારો કયાં છે? (18)

ENGLISH VERSION

- Que-1 Explain the meaning and concept of Central Excise Law. (20)
OR
- Que-1 (A) How do you evaluate excisable goods? (10)
(B) Which types of goods are excisable goods? (10)
- Que-2 Write a note on CENVAT. (20)
OR
- Que-2 (A) Central Excise – Job work. (10)
(B) Explain – Exemption to SSI in central excise (10)
- Que-3 What is custom duties? What are its concepts? (18)
OR
- Que-3 Explain the meaning of territorial waters and high seas under custom law. (18)
- Que-4 What is the procedure of assessment of customs duty in case of import and export of goods? (18)
OR
- Que-4 What are the types of custom duties? (18)
